



RAN-2301001201030571

B.A. (NEP) (Sem. - I) Examination November - 2025

Economics - I (Minor) - Micro Economics (Paper - I)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) જમણી બાજુ પ્રશ્નોના ગુણ દર્શાવવામાં આવ્યા છે.
The Question marks are shown on the right.
- (3) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
All questions are mandatory.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. નીચેના પ્રશ્નનો ટૂંકમાં જવાબ લખો (કોઈપણ પાંચ) (10)

1. એકમલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ જણાવો.
2. માંગમાં વધારો અને ઘટાડો શેના કારણે થાય છે?
3. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જણાવો.
4. અવેજી અસર એટલે શું?
5. તૃષ્ટિગુણના પ્રકાર જણાવો.
6. વૈકલ્પિક ખર્ચ એટલે શું?
7. લાંબા ગાળાની ખર્ચના વક્રની લાક્ષણિકતાઓ જણાવો.

પ્ર. 2. પ્રો. જે. કે. મહેતાના આર્થિક વિચારોને વિસ્તારથી સમજાવો. (13)

અથવા

- અ. માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની પદ્ધતિઓ વિગતે સમજાવો. (06)
- બ. માંગનું વિસ્તરણ અને સંકોચન સમજાવો. (07)

પ્ર. 3. ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ વિસ્તારથી સમજાવો. (13)

અથવા

- અ. ટૂંકા ગાળામાં ઉત્પાદન અને ખર્ચ વચ્ચેના આંતરસંબંધ સમજાવો. (06)
- બ. ખર્ચના પ્રકારો સમજાવો. (07)

પ્ર. 4. ટૂંકનોંધ લખો (કોઈપણ બે) (14)

1. રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યાની જે.કે. મહેતાએ કરેલ ટીકાઓ
2. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ
3. ગ્રાહકની સમતુલા
4. બિનપ્રમાણસર ઉત્પાદનનો નિયમ

ENGLISH VERSION

- Q. 1. Answer the following question briefly. (Any Five) (10)**
1. State the limitations of microeconomics.
 2. What causes an increase or decreases in demand?
 3. Define price elasticity of demand.
 4. What is the substitution effect?
 5. State the types of utility.
 6. What is opportunity cost?
 7. State the characteristics of the long-run cost curve.
- Q. 2. Explain the economic ideas of Prof. J.K. Mehta in detail. (13)**
- OR**
- Q. 2. (A) Explain the methods of measuring price elasticity of demand in detail. (06)**
(B) Explain expansion and contraction of demand. (07)
- Q. 3. Explain the concept of consumer's surplus in detail. (13)**
- OR**
- Q. 3. (A) Explain the relationship between production and cost in the short run. (06)**
(B) Explain the types of cost. (07)
- Q. 4. Write short notes. (Any two) (14)**
1. Prof. J.K. Mehta's criticisms of Robbins' definition of Economics
 2. Concept of cross-price elasticity of demand
 3. Consumer's equilibrium
 4. Law of variable proportions
-